

સરદાર સ્મૃતિ કેન્દ્ર, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ

અને આત્મા પ્રોજેક્ટ - જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે

" આદર્શ પશુપાલન, બાગાયત અને ગૃહ વિજ્ઞાન " વિષય પર પ્રગતિશીલ ખેડૂત બહેનોનો તાલીમ વર્ગ

તાલીમાર્થીઓ : વંથલી તાલુકાના પ્રગતિશીલ ખેડૂત બહેનો
તાલીમનો સમયગાળો : તા. ૨૪. ફેબ્રુઆરી - ૨૦૨૨
તાલીમાર્થીઓની અંદાજિત સંખ્યા : ૫૦ (પચાસ)
તાલીમનું સ્થળ : સરદાર સ્મૃતિ કેન્દ્ર, જૂ.કૃ.યુ., જૂનાગઢ


-:: તાલીમ સંકલનકાર ::-

પ્રો. વી. જી. બારડ

મદદનીશ વિસ્તરણ શિક્ષણશાસ્ત્રી(માહિતી)

-:: તાલીમ કાર્યક્રમ ::-

સમય	વિષય	વક્તા
૦૯.૦૦ થી ૦૯.૩૦	આગમન અને નોંધણી	કુ. પી.બી. અસવાર
૦૯.૩૦ થી ૧૦.૦૦	તાલીમ વર્ગનું ઉદ્ઘાટન	ડો. એચ.એમ.ગાજીપરા વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી
૧૦.૦૦ થી ૧૧.૦૦	સ્વચ્છ દૂધ ઉત્પાદન, દુધની બનાવટ અને નફાકારક આર્થિક ઉપાર્જનના ઉપાયો અને ચર્ચા	ડો. એસ.ડબલ્યુ.સાવરકર પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય
૧૧.૦૦ થી ૧૧.૩૦	કૃષિ દર્શનાલયની મુલાકાત	કુ. પી.બી. અસવાર
૧૧.૩૦ થી ૧૨.૩૦	પશુ ઉછેર કેન્દ્રની મુલાકાત અને પશુપોષણ, માવજત અને ચર્ચા	શ્રી એચ.એમ.કુંજડિયા
૧૨.૩૦ થી ૧૫.૦૦	ભોજન વિરામ	
૧૫.૦૦ થી ૧૬.૩૦	બેકરીશાળાના અભ્યાસક્રમ વિશેની માહિતી અને ઘરગથ્થુ રીતે બેકરીઓની બનાવટ અને નિદર્શન (સ્થળ : બેકરી શાળા)	પ્રો. એમ.વી.કપોપરા, મદદનીશ વિસ્તરણ શિક્ષણશાસ્ત્રી, બેકરી શાળા
૧૬.૩૦ થી ૧૭.૩૦	ફળ અને શાકભાજીનું પરિરક્ષણ અને બનાવટનું નિદર્શન (સ્થળ : બાગાયત વિભાગ)	પ્રાધ્યાપક અને વડા, બાગાયત વિભાગ
૧૭.૩૦ થી ૧૮.૦૦	પ્રતિભાવ અને સમાપન	પ્રો. વી. જી. બારડ


વિસ્તરણ શિક્ષણ નિયામક
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી,
જૂનાગઢ

જા.નં./જૂકૃયુ/મ.વિ.શિ.શા.(મા)/સસકે/ટેક-૨/તાલીમ/ ૫૧૩-૧૨૨ /૨૦૨૨ જૂનાગઢ તારીખ: ૨૧/૦૨/૨૦૨૨

નકલ સવિનય સાથે રવાના :

૧. સંશોધન નિયામકશ્રી, જૂ.કૃ.યુ., જૂનાગઢ તરફ જાણ થવા સારું.
૨. આચાર્ય અને ડીનશ્રી, પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનું યુનિવર્સિટી, જૂનાગઢ તરફ જાણ થવા સારું.
૩. વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની ટેક-૩ શાખા તરફ જાણ સારું.

૪. નિયામકશ્રી આઈ.ટી.સેલ., જૂ.કૃ.યુ., જૂનાગઢ વેબસાઈટ પર ન્યુઝ રૂપે મુકવા સારું.

નકલ જયભારત સાથે રવાના:

૧. સંબંધિત વક્તાશ્રીઓ/વિભાગીય વડાઓને જાણ તથા વ્યાખ્યાન સમયે હાજર રહેવા સારું.
૨. પ્રતિશ્રી, પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા પ્રોજેક્ટ - જૂનાગઢ તરફ જાણ તથા તાલીમાર્થીઓ સમયસર તાલીમ કેન્દ્ર પર પહોંચે તે માટે ઘટતું થવા સારું.